KENVI JEWELS LIMITED

Registered Office: Shop No. 121 & 122, Super Mall Complex, Nr Lal Bunglow, CG Road, Ahmedabad, Ahmedabad, Gujarat, 380006.

CIN: L52390GJ2013PLC075720 E-Mail: compliance.kjl@gmail.com

Website: www.kenvijewels.com Ph.: 079-22973199, 2289109

Date: 31-05-2024

To
The General Manager-Listing
Corporate Relationship Department
The BSE Limited
P J Tower Dalal Street, Mumbai-400001
Scrip Code: 540953

Sub: Submission of copies of Newspaper Advertisement pursuant to Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015

Ref: Kenvi Jewels Limited (Script Code - 540953) Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015,

please find enclosed copies of financial results of the Company for the quarter and year ended 31st March, 2024 published in the following newspapers dated on 31st May, 2024:

- 1. Business Standard (English)
- 2. Jai Hind (Gujarati)

Kindly take the information on record and oblige.

Thanking You,

For, KENVI JEWELS LIMITED

VALANI Digitalily sign ed by VALANI CHRACKUMAR Date: 2024.05.31

Chiragkumar Valani Managing Director DIN: 06605257

PALM JEWELS LTD. CIN: L36910GJ2005PLC046809 Registered Office: C/205, D/205, 2nd Floor, Super Mall, Besides Lal Bungalow, C.G. Road, Ahmedabad, Gujarat, 38000 || Email id : compliance.pjl@gmail.com; || Tel. No. : +91-079-40052056: || Web : www.palmiewels.com

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2024 Quarter Quarter Quarter 31-03-2024 31-03-2023 Audited Unaudited Audited Audited Audited 4025.59 12037.52 16063.1 9987.02 Total Income 2327.49 Net Profit for the year before tax 15.92 15.28 45.6 39.48 Net Profit for the year after tax

Total Comprehensive Income for the year 27.99 30.48 12.92 30.48 27.99 13.28 1004.10 Paid up Equity Share Capital 1004.10 1004.10 1004.10 1004.10 Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted 0.13 0.28 0.13 0.35 0.30

Notes: (a) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 29.05.2024 (b)The Statutory Auditors have carried out Limited Review of the above standalon financial results for the quarter ended on March 31st, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations) Disclosure Requirements) Regulations, 2015. (c) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity (www.bseindia.com) (d) The figures for the previous year/periods are re-arranged/re-grouped, wherever considered necessary For and on behalf of Palm Jewels Limited sd/- **Rohit Shah**, Managing Director - DIN: 00543440 Place : Ahmedabad Date : 30/05/2024

2

BHAGWATI AUTOCAST LIMITED

(CIN: L27100GJ1981PLC004718)

Regd. Office: Survey No.816, Village: Rajoda, Nr. Bavla, Dist. Ahmedabad-382220, Gujarat, India Phone: +91 2714 232283 / 232983 / 232066 E-mail: cs@bhagwati.com Website: www.bhagwati.com

Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority

NOTICE is hereby given pursuant to the provisions of Section 124 (6) of the Companies Act, 2013 (the Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules 2016 ("the Rules") as amended from time to time. As per the Rules, the Company needs to transfer the shares held by the shareholders either in physical form or dematerialized form to the Investor Education and Protection Fund Authority (IEPF Authority") in respect of which dividends has not been claimed for seven consecutive years or more.

In accordance with the provisions of the Rules, shareholders may note that the unclaimed/unpaid dividend for the financial year 2016-2017 would be transferred to IEPF Authority along with underlying shares in respect of which dividend has not been claimed for seven consecutive years from the financial year 2016-2017 onwards, Adhering to the various requirements set out in the Rules, individual notices have already been sent to the respective shareholders at their latest available address in the records of the Company / Registrar and Share Transfer Agent (RTA), inter alia providing the details of shares being transferred to IEPF Authority and list of such shareholders are available on the website of Company and can be accessed at www.bhagwati.com.

The concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Authority, may note that the company would be issuing new share certificate(s) in lieu of the original certificate(s) held by such shareholder for the purpose of transfer of shares to IEPF Authority and upon such issue, the Company shall inform the depository by way of corporate action to convert the new share certificate(s) into demat form and transfer in favour of IEPF Authority. The original share certificate(s) which are registered in the name of shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. The concerned shareholders holding shares in dematerialized form and whose shares are liable to be transferred to IEPF Authority, may note that the company shall inform the depository by way of corporate action for transfer of shares in favour of the demat account of the IEPF Authority.

For claiming of unpaid / unclaimed dividend, the concerned shareholder may request on or before 30th September, 2024 to Bhagwati Autocast Ltd., Survey No. 816, Village: Rajoda, Near Bavla, Dist. Ahmedabad-382220, E Mail: cs@bhagwati.com or the Company's RTA i.e. M/s. MCS Share Transfer Agent Limited (Unit: Bhagwati Autocast Ltd.) at 101, Shatdal Complex, Opp. Bata Show Room, Ashram Road, Ahmedabad-380009, Tel No .:- (079) 26580461/62/63, e-mail: mcsstaahmd@gmail.com. The Company shall with a view to adhering with the Rules, transfer the shares to the IEPF Authority by the due date. Consequent thereto, no claim shall lie against the Company in respect of such unpaid / unclaimed dividend and underlying shares. The concerned shareholder may note that upon such transfer, they can claim the said shares along with dividend(s) including all benefits on such shares, if any, from IEPF Authority, details of which are available at www.iepf.gov.in.

For, Bhagwati Autocast Limited Place: Ahmedabad

Niren A. Desai Company Secretary & Compliance Office



Name of

Branch Office: ICICI Bank Limited, Heritage Chambers, 2nd Floor Near Azad Society Cross Road, Nehrunagar, Ahmedabad- 380015

PUBLIC NOTICE - TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET

[See proviso to rule 8(6)] Notice for sale of immovable assets

Details of the

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis as per the brief particulars given hereunder Amount Reserve Date and Date &

No.	Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Secured asset(s) with known encumbrances, if any	Outstanding	Price Earnest Money Deposit	Time of Property Inspection	Time of E-Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Shree Radheshayam Trading Co. By Represented by its Partners Jayantibhai Dalubhai Baka alias Jayntibhai Patel Baka, Pravinbhai Virsanghbhai Judal and Pravinbhai Nathubhai Judal (Borrower) Jayantibhai Dalubhai Baka alias Jayntibhai Patel Baka, Pravinbhai Nathubhai Judal, Pravinbhai Virsangbhai Judal (Guarantors) A/c No.60205005459,	Shop Cum Godown No. F-16. Revenue Survey No. 1177/P +1178/P +1180/P +1180/P +1186/P +1186/P +1188/P +1189/P, Agriculture Produce Market Palanpur, Dairy Road To Gobari Road, Navagunj, Taluka Palanpur, District Banaskantha, Gujarat. Admeasuring an area 1958 Sq. FtFree Hold Property	Rs. 69,59,340/- (as on May 02, 2024)	Rs. 63,50,000/- Rs. 6,40,000/-	June 20, 2024 11:00 AM To 12:00 Noon	July 12, 2024 From 11:00 AM Onwards

The online auction will take place on the website of e-auction agency M/s NexXen Solutions Private Limited. (URL Link- https://disposalhub.com). The Mortgagors/ Noticee are given last chance to pay the total dues with further interest till July 11, 2024 before 04:00 PM failing which, this/these secured asset/s will be sold as

per schedule.
The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Limited, Heritage Chambers, 2nd Floor, Near Azad Society Cross Road, Nehrunagar, Ahmedabad- 380015 or before July 11, 2024 before 03:00 PM and thereafter they need to submit their offer through the above mentioned website only on or before July 11, 2024 before 04:00 PM along with scan image of Bank acknowledged DD towards proof of payment of EMD. Kindly note, in case prospective bidder(s) are unable to submit their offer through the website then signed copy of tender documents may be submitted at ICICI Bank Limited, Heritage Chambers, 2nd Floor, Near Azad Society Cross Road, Nehrunagar, Ahmedabad- 380015 on or before July 11, 2024 before 05:00 PM Earnest Money Deposit DD/PO should be from a Nationalised/Scheduled Bank in favour of "ICICI Bank Limited" payable at Ahmedabad.

En any further clarifications with regards to inspection, terms and conditions of the E-auction or submission of

For any further clarifications with regards to inspection, terms and conditions of the E-auction or submission of tenders, kindly contact ICICI Bank Limited on 7573024297. Please note that Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited 2. Augeo Asset Management Private Limited have also been engaged for facilitating the sale of this property.

The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons For detailed terms and conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

ICICI Bank Limited

together with relevant rules issued there under and other accounting principles generally accepted in India

PUBLIC NOTICE FOR TITLE CLEARANCE

This public notice is hereby given to whomsoever may concern that Mukesh Laxminarayan Pathak, the owner of the property bearing Plot No. 134 and Northern portion of adjoining Plot No.: 133 total admeasuring 66.93 sq.Mts. along with construction made thereon of the society known as "Sai Krupa Residency" situated at the land bearing R.S. Nos. 17/2/A & 46/1/A, Block No. 24 of Mouje: Karadva, Tal. Choryasi, District: Surat, asked for the title clearance certificate, it is submitted before me that the Original Registration Fee Receipt of Registered sale deed No.: 6821 Dated :- 30.11.2018 is misplaced. If any person, Bank, or Financial institute has any interest in the said property, contact me at my address mentioned herein below within 7 DAYS of publication of this notice with all relevant document. Upon expiration of the notice period, if no objection will be received by me, I will issue Title Clearance Report for the said property. Thereafter nobody has any right, interest in the said property and if anybody has any rights or interest in the said property, he/she has waved the said right. Subsequently No Objection will be considered. Please note.

JIGISHA KETAN SHAH (ADVOCATE) Offi.: A-33, 3rd Floor, River palace, Beside Navdi Ovara, Nanpura, Surat, Mo.: 98252 94942

Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each)

Basic & Diluted

pnb punjab national bank VADODARA CIRCLE: (Vadodara Stock **Exchange Building, Ground Floor,** Fortune Tower, Sayajiguni, Vadodara- 390020, Ph. No. 0265 - 2990207

CORRIGENDUM

Change of Name

OLD NAME

JYOTSNABEN AMRUTBHAI JADAV

NEW NAME

JYOTSNABEN AMARATBHAI JADAV

48, Shiv Sanidhya, Nr.Somnath Mandi

: Address :

Mehsana-384001, Gujarat

General Public is informed that undersigned had Published PREMISES REQUIRED FOR PALEJ BRANCH in "Business Standard" on 17.05.2024, in which please read as in "The complete offer duly sealed & signed and should reach the undersigned on or before 15.06.2024 at 05:00 PM at the above address." All other details wil remain unchanged, which please note. Date: 30-05-2024

KENVI JEWELS LIMITED CIN: L52390GJ2013PLC075720 Registered Office: Shop No.121 & 122 Super Mall Complex, Nr. Lal Bunglow, CG Road, Ahmedabad, Ellisbridge, Gujarat- 380006 || Email id : compliance.kjl@gmail.com || Ph No.: 079-22973199, 2289109 || Web : www.kenvijewels.com

	QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2024 (Rs. in Lakhs)											
Sr. No	Particulars	Quarter ended on 31-03-2024 Audited	Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2024 Audited	Year ended on 31-03-2023 Audited						
1	Total Income	3206.52	8935.51	2850.46	12142.03	8827.80						
2	Net Profit for the year before tax	11.08	70.57	38.06	81.65	73.75						
3	Net Profit for the year after tax	10.54	55.57	27.13	66.11	53.82						
4	Total Comprehensive Income for the year	10.54	55.57	27.13	66.11	53.82						
5	Paid up Equity Share Capital	1263.80	1263.80	1011.04	1263.80	1011.04						

Notes: (a) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 30.05.2024 (b) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended on March 31st, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (c) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity, (www.bseindia.com) (d) The figures for the previous year/periods are re-arranged/re-grouped, wherever considered necessary. Place: Ahmedabad For and on behalf of Kenvi Jewels Limited sd/- Chirag Valani, Managing Director - DIN: 06605257

0.08

0.44

VEERAM SECURITIES LIMITED CIN: L65100GJ2011PLC064964 Registered Office: Ground Floor & First Floor, 7, Natvarshyam Co Op Ho So Ltd, Opp. Orchid Park, Ramdevnagar Road, Sattelite, Vejalpu Ahmedabad, Gujarat, 380051 || Email id: compliancingveeram@gmail.com; || Tel. No.: +91-9925266150 || Web:www.veeramsecuritiesItd.cc

	STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2024 (Rs. in Lakhs)											
Sr. No	Particulars	Quarter ended on 31-03-2024 Audited	Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2024 Audited	Year ended on 31-03-2023 Audited						
	Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted	527.38 149.15 97.57 97.57 1512.82 0	1424.92 180.5 148.6 148.6 1512.82 0	263.20 37.12 41.11 41.11 1512.82 0	1952.30 329.65 246.17 246.17 1512.82 0	1884.85 231.9 178.9 178.9 1512.82 0						

Notes: (1) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 29.05.2024 (2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended on March 31st, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (3) The above is an extract of the detailed format of Annual Financial Results filed Disclosure Requirements) Regulations, 2015. (3) The above is an extract of the detailed format of Riman Propositions with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Discoure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (4) The figures for the previous year/periods are re-arranged/re-grouped, wherever considered necessary Place: Ahmedabad For and on behalf of Veeram Securities Limited Date: 29/05/2024 sd/- Mahendrabhai Ramniklal Shah, Managing Director - DIN: 03144827

OMKAR PHARMACHEM LIMITED

Regd. Off. 310, Wall Street-1, Near Gujarat College Cross Road, Ellisbridge, Ahmedabad-380006. Ph. +91 9711811163 CIN: L93000GJ1995PLC025276 Website: www.omkarpharmachem.co.in Email: investors.opl@gmail.com

Extract of the Standalone Audited Results for the Quarter and Year ended 31st March, 2024 (Rs. in lakh except per share data).

(Normalia diception di alla					
Particulars	Quarter Ended (Audited) 31.03.2024	Year Ended (Audited) 31.03.2024	Quarter Ended (Audited) 31.03.2023	Year Ended (Audited) 31.03.2023	
Total income from Operations (Net)	13.50	54.00	13.50	54.00	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	4.78	25.28	5.83	26.45	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)		25.28	5.83	26.45	
Net Profit(Loss)for period after tax (after Exceptional items)	(1.59)	18.91	(0.84)	19.78	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)					
for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(1.59)	18.91	(0.84)	19.78	
Equity Share Capital (Face Value Rs. 10/-each)	1008.37	1008.37	1008.37	1008.37	
Other equity	(85.09)	(85.09)	(104.00)	(104.00)	
Earning Per Share(before & after extraordinary items)(of Rs. 10 each)					
Basic and diluted Rs.	(0.02)	0.19	(0.01)	0.20	

Date : 30.05.2024

Place : Ahmedahad

- 1) The above is an extract of the detailed format of Audited Quarterly and Yearly Ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Other and Disclosure Requirements) Regulations, 2015. The full formation of the Audited Quarterly and Annual Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on the
- Company's website www.omkarpharmachem.co.in 2) The above results have been reviewed by the audit committee & approved by the Board of Directors at their respective meeting
- held on 30th May, 2024. 3) Exceptional items/Extraordinary items, if any, are adjusted in the statement of profit and loss in accoudance with IND-AS rules

By order of the Board For, Omkar Pharmachem Limited Sd/-Bhawani Shankar Goyal

Managing Director DIN: 03255804

Address: House No. 155/2. First Floor, Gali No. - 2. Nr. Gurudwara, Govindpuri, Kalkaji, Delhi - 110019

BANGO

BANCO PRODUCTS (INDIA) LIMITED

Regd. Office: Bil, Near Bhaili Rly. Station, Padra Road, Dist. Vadodara - 391 410. Tel. No.: (0265) 2318226 CIN NO:- L51100GJ1961PLC001039, Website: - www.bancoindia.com, E-mail:- investor@bancoindia.com EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH 2024 (Rs. in Lakhs)

			Standalone			Consolidated				
Particulars	Quarter ended 31.03.2024 (Audited)	Quarter ended 31.12.2023 (Unaudited)	Quarter ended 31.03.2023 (Audited)	Year ended 31.03.2024 (Audited)	Year ended 31.03.2023 (Audited)	Quarter ended 31.03.2024 (Audited)	Quarter ended 31.12.2023 (Unaudited)	Quarter ended 31.03.2023 (Audited)	Year ended 31.03.2024 (Audited)	Year ended 31.03.2023 (Audited)
Total income from Operations	29,180	27,036	26,650	115,372	113,623	73,031	58,248	61,232	280,616	234,750
Net profit /(loss) for the period (before tax, exceptional and/or extra ordinary items)	6,203	7,058	5,308	29,735	28,095	8,559	8,051	7,409	36,270	31,083
Net profit /(loss) for the period before tax (after exceptional and/or extra ordinary items)	6,203	7,058	5,308	29,735	28,095	8,559	8,051	7,409	36,270	31,083
Net profit /(loss) for the period after tax (after exceptional and/or extra ordinary items)	5,338	6,074	4,491	25,523	24,554	6,816	6,832	5,103	27,140	23,558
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for ther period (after tax) and Other Comprehensive Income (after tax)	5,284	6,074	4,493	25,469	24,552	6,961	7,759	5,221	29,317	22,003
Equity Share Capital	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	He 72 /39/-Lakhe as on 31st March 2024 L He 1 03 666/- Lakhe as on 31st March 2024					24				
Earning per share (of Rs. 2 /- each) (for continuing and discontinued operations)										
Basic	7.46	8.49	6.28	35.69	34.33	9.53	9.55	7.14	37.95	32.94
Diluted	7.46	8.49	6.28	35.69	34.33	9.53	9.55	7.14	37.95	32.94

Note: The above is an extract of the detailed format of the audited Financial Results of the Company for the Quarter and Year ended 31st March, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and Year ended on 31st March, 2024 are available on the website of BSE Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company at www.bancoindia.com. (2) The above results (Standalone and Consolidated) have been prepared in accordance with Indian Accounting Standards ('IND AS) notified under section 133 of the companies Act 2013, read

For Banco Products (India) Limited

(Mehul K. Patel)

人 Zota

CIN: L24231GJ2000PLC038352 Registered office: Zota House, 2/896, Hira Modi Street, Sagrampura, Surat-395002, Gujarat Ph: +91-261-2331601, Email: info@zotahealthcare.com | Website:www.zotahealthcare.com EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024

(Rs. in Lakhs, except per share da								
Sr.			STANDALO	NE	CONSOLIDATED			
No.	Particulars	Quarter ended March 31, 2024 (Audited)	Year Ended March 31, 2024 (Audited)	Quarter ended March 31, 2023 (Audited)	Quarter ended March 31, 2024 (Audited)	Year Ended March 31, 2024 (Audited)	Quarter ended March 31, 2023 (Audited)	
1	Total Income from operations	4734.96	16658.50	3625.74	4963.56	18048.85	3684.89	
2	Net Profit for the period (before tax, exceptional and /or extraordinary items)	15.62	490.61	13.41	(950,81)	(1616,29)	(363,18)	
3	Net Profit for the period before tax (after exceptional and /or							
	extraordinary items)	15.62	490.61	67.20	(950.81)	(1616.29)	(309.39)	
4	Net Profit for the period after tax (after exceptional and / or extraordinary items)	22.33	337.99	65.41	(691.77)	(1434.79)	(263.48)	
5	Total Comprehensive income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax)]	25.23	352.82	85.79	(685.74)	(1416.42)	(242.40)	
6	Paid-up Equity Share Capital (face value of Rs.10/-each)	2584.73	2584.73	2516.03	2584.73	2584.73	2516.03	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	2231110	9592.80	22.000	2221170	6412.92	2570100	
8	Earnings Per Share (face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)							
	1. Basic: 2. Diluted:	0.09 0.08	1.32 1.29	0.26 0.26	(2.68) (2.62)	(5.59) (5.47)	(1.05) (1.05)	

0.53

1. The above is an extract of the detailed format of Quarterly and Year to Date Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year to Date Financial Results are available on the websites of the National Stock Exchange of India at www.nseindia.com and on the website of the Company at the www.zotahealthcare.com.
2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on May 29, 2024.
3. The Audit as required water Destrictions of the State of the

May 29, 2024.

3. The Audit as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

4. The Board of Directors in its meeting held on May 29, 2024 has recommended the final dividend at the rate of 10% i.e. Re. 1/- per equity share for the financial year 2023-24, subject to the approval of shareholders at the ensuing Annual General meeting of the Company.

For and on behalf of Board of Directors o Zota Healthcare Limited

Ashvin Variya Place : Surat. (Company Secretary & Compliance Officer Date: 30/05/2024



Ajwa Fun World & Resort Limited

CIN: L45201GJ1992PLC018294 Regd. Office: Ajwa-Nimeta Road, P.O.: Ajwa Compound-391510, Tal: Waghodia, Dist: Baroda. (Gujarat)

	FOR THE QUARTER AND YEAR	LIND			cept per s	
		Qu	arter En	ded	Year I	Ended
SR NO	PARTICULARS	For the Quarter Ended 31.03.24	For the Quarter Ended 31.12.2023	For the Quarter Ended 31.03.23	Year Ended 31.03.24	Year Ender 31.03.2
		AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITE
1	Revenue from operations a) Net Sales/Income from Operations (Excluding Transfer) (Net of Excise Duty)	51.21	18.75	76.47	256.56	274.3
	b) Other Operating Income Total Income from Operations (net)	1.01 52.22	0.97 19.72	2.03 78.50	4.08 260.64	50.2 324. 5
2	Expenses a) Cost of Material Consumed b) Purchase of Traded Goods c) Changes in Inventories of Finished Goods, Work-in-Progress and Stock-in-Trade	1.28	1.07 -	1.85	17.54 -	88.4
	d) Employee Benefit Expenses e) Finance Costs f) Depreciation and Amortization expenses	15.92 7.22 4.93	17.29 4.83 4.93	2.98 4.89	66.92 20.12 19.74	34.0 9.6 19.5
	g) Other Expenses Total Expenses	31.53 60.88	22.48 50.60		125.69 250.01	148.6 298.4
3	Profit /(Loss) from Operations before Exceptional and Extra Ordinary Item & Tax (1-2)	(8.66)	(30.88)		10.63	26.1
4 5	Exceptional Items - Expenditure / (Income) Profit / (Loss) from Ordinary Activities before Extra Ordinary Items & Tax (3 ± 4)	(8.66)	(30.88)	5.27	10.63	26.1
6 7	Extraordinary Items Profit / (Loss) before Tax (5 ± 6)	0.00	0.00 (30.88)	0.00 5.27	0.00 10.63	0.0 26 .1
8	Tax Expense (1) Current Tax (2) Deferred Tax	-		-	-	
9 10	Profit / (Loss) for the Period (7 ± 8) Other Comrehensive Income (After Tax)	(8.66)	(30.88)	5.27	10.63	26.1
11 12	Total Comrehensive Income (9 ± 10) Paid up Equity Share Capital (Face Value Rs. 10/- each)	(8.66) 639	(30.88) 639	5.27 639	10.63 639	26 .1
13	Earning Per Share (after extraordinary Items - Not annualised) (a) Basic (b) Diluted	(0.14)	(0.48)	0.08	0.17	0.4

AUDITED STANDALONE OF ASSETS AND LIABILITES AS ON 31st MARCH 2024 (Rs. in Lacs

31st March, 2024 31st March, 2023 **PARTICULARS** I ASSETS 1 Non-current assets (a) Property, Plant and Equipment (b) Capital Work in Progress 279.80 274.36 (c) Other Non Current Assets **Total Non Current Assets** (a) Inventories 0.79 (a) Financial assets I) Investments ii) Trade receivables 3.39 9.43 iii) Cash and cash equivalents 20.93 iv) Loans 256.65 155.16 (b) Other current assets 5.64 **275**.11 14.60 194.54 **Total Current Assets Total Assets** I EQUITY AND LIABILITIES (a) Equity share capital (b) Other equity 639.00 639.00 (858.41) (219.41) (869.04) (230.04) Total Equity Non Current Liabilities (a) Financial Liabilities (i) Borrowing (b) Deferred Tax Liability Total Non Current Liabilities **Current liabilities** (i) Borrowing 541.89 401.33 (ii) Trade Payables (iii) Other Financial Liablities 279.20 290.16 (b) Other Current Liabilities **Total Current Liabilities** 879.9° 804.54 Total Liabilities

Date: 29-05-2024

By and on Behalf of Board of Dire For AJWA FUNWORLD AND RESORT LTD Managing Director DIN 00285542

660.50

574.49

ACRE

ASSETS CARE & RECONSTRUCTION ENTERPRISE LIMITED (ACRE)

TOTAL EQUITY AND LIABILITIES

CORPORATE OFFICE: Unit No. 502, C Wing, ONE BKC, G - Block, Bandra Kurla Complex, Mumbai - 400051 REGISTERED OFFICE: 14th Floor, Eros Corporate Tower, Nehru Place, New Delhi - 110019

APPENDIX IV-A [See proviso to Rule 8(6)] Sale Notice for Sale of Immovable Property

-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets an inforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described movable Property mortgaged to Nido Home Finance Limited (Formerly Known as Edelweiss Housing Finance Limited) 'Secured Creditor"), the physical possession of which has been taken on 18-02-2024 by the Authorised Officer of the cured Creditor, will be sold on "as is where is", "as is what is" and "whatever there is" basis on 03.07.2024 from 02.00 P.M. to 04.00 P.M., for recovery of Rs.14,19,214.87/- (Rupees Fourteen Lakh Nineteen Thousand Two Hundre ourteen and Eighty Seven Paisa Only) pending towards Loan Account No. LSUR0HL0000045461, by way of out standing principal, arrears (including accrued late charges) and future interest in terms of the Loan Agreement and ther related loan document(s) w.e.f. 30.03.2024 along with legal expenses and other charges due to the Secure

Creditor from 1. Vishal B Kukadiya (Borrower) & 2. Babubhai N Patel The Loan Account along with underlying security has been assigned by Nido Home Finance Limited (Formerly known as Edelweiss Housing Finance Limited) to the Assets Care & Reconstruction Enterprise Limited (ACRE), acting as a Trustee of ACRE-80-Trust vide Assignment Agreement dated 04.05.2023. By virtue of the said Assignment of Debt ACRE as stepped into the shoes of NIDO and become entitled to deal with the said loan account including enforcement of securit

nd recovery of outstanding dues. The Reserve Price for the Immovable Property will be Rs.14,20,500/-(Rupees Fourteen Lakhs Twenty Thousand Five

lundred Only) and the Earnest Money Deposit ("EMD") will be Rs. 1,42.050/- (One Lakh Forty-Two Thousand Fifth only) i.e. equivalent to 10% of the Reserve Price.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All That Right, Title And Interest Of Property Bearing Plot No. 240 Admeasuring 42.38 Sq. Mts. Undivided Share In The Land Of Road & C.O.P. In "Shubh Global Village" Situated At Block No. 32, Revenue Survey No. 41 & 42 As Per 7/12 Adeasuring 64095 Sq. Mts. Akar Rs. 62.81 Paise, Of Mauje Village Valenja, Ta: Kamrej, Dist: Surat. Bounded As: North: Plot No. 241, South: Plot No. 239, East: Plot No. 233, West: Society Road

or detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Cre .e. www.acreindia.in; For bidding, log on to www.auctionfocus.in

AUTHORIZED OFFICER ASSETS CARE & RECONSTRUCTION ENTERPRISE LTD (ACRE)
TRUSTEE OF ACRE-80-TRUST

Place: Vadodara Date: 29.05.2024

Chairman



ભાભરમાં ચોરેલી બાઈકો સાથે શખ્સને ઝડપી લેવાયો હતો. (તસ્વીર : મહેન્દ્ર ઠક્કર - ભાભર)

અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

ભાભરમાં ચોરેલી ૭ બાઈક સાથે રિઢો આરોપી ઝડપાયો

ભાભર, તા.૩૦ હોવાનું જશાવ્યું હતું.

બનાસકાંઠા એલ.સી.બી. સ્ટાફ ભાભર પોલીસ સ્ટેશન જુદા વિસ્તારમાંથી ચોરી કરેલ વિસ્તારમાં ચોરીના ગુના સાત બાઇક કુલ કિંમત રૂપીયા ઉકેલવાના કામે પેટ્રોલિંગમાં હોય ૨૨૫૦૦૦/-નાં કબજે કર્યા હતાં તે દરમ્યાન ઇસમ બાઇક સાથે જયારે અબદ્દલ રીઝવાનને ઝડપી

શંકાસ્પદ શ કાસ્પદ લાગતાં અને **જુદા જુદા વિસ્તારમાંથી** _{ચોરીમાં} સામેલ તેની પાસેના **બાઈકની ચોરી કર્યાની** અરવિંદ દરગા બાઇકનો નંબર કબુલાત કરી

પોકેટ કોપમા

સર્ચ કરતાં બાઇક શંકાસ્પદ તા.થરાદ) તથા દર્શન પ્રભુરામ લાગતાં તે ઇસમની પછપરછ જોષી (રહે.વાસરડા.તા.થરાદ)ને કરતાં તેનું નામ-સરનામુ પુછતાં પકડવાનાબાકી હોઇ ત્રણેય ઇસમો તે દિયોદર તાલુકાના લુદ્રા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી ગામનો રીઝવાન અબદુલ સુમરા કરવામાં આવી છે.

પુછપરછ કરતાં તેશે જૂદા

લીધો હતો તેમજ

(રહે.લુણવા,



અંકલેશ્વરમાં શ્રમિકો માટે ચાલતી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફ્ટીના અભાવે બંધ કરવામાં આવી હતી.

(તસ્વીર: અયાઝ શેખ - અંકલેશ્વર)

જરૂરી ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી

અંકલેશ્વરમાં ઈએસઆઈસી હોસ્પિટલ બંધ કરવામાં આવી

અંકલેશ્વર, તા.૩૦ ઈએસઆઈસી હોસ્પિટલમાં **ડાભા ગામે ઝાંઝરી ધોધમાં** ભરૂચ જિલ્લામાં પાલિકાના ફાયર સેફ્ટી ન હોય ત્યારે ફાયર વિભાગ દ્વારા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેમઝોન, _{સો માં} _____ સુધી કાયર હાથ **દર્દીઓને સરકારી અને** સેફ્ટી ઉપલબ્ધ ક્લાસિસો માંં

ખાનગી હોસ્પિટલમાં ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે ધરવામાં આવ્યું તે માં ય બંધ કરવામાં ભરૂચમાં બે

–આવી હતી. ગેમઝોનમાં -એનઓસી ન હોય તેમને બંધ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કરવાની નોટિસ ફટકારવામાં દર્દીઓને તાત્કાલિક ધોરણે અન્ય ગયા હતા. આવી છે ત્યારે એશિયાની સૌથી સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં જેમાં એક યુવકને તરતા આવડતું હોવાથી તે બહાર મોટી જીઆઈડીસી અંક્લેશ્વરની શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ક્ષતિગ્રસ્ત સ્થળના જવાબદારોને નોટિસ અપાઈ

મોડાસામાં ફાયર સેફ્ટી કમિટી દ્વારા ૩૦ એકમની સ્થળ તપાસ કરાઈ

મોડાસા, તા.૩૦ બીજીબાજુ રાજ્યમાં ફાયર ઘટના બાદ ફાયર સેફ્ટી અંગે રાજકોટના ટીઆરપી ઝોનમાં સે ફ્રટીમાં

સેક્ટી વિભાગ **ફાયર સેક્ટી અને** દ્વારા તેમજ વહીવટી તંમજ વહાવટા તંત્રદ્વારા કમિટી **વહીવટી તંત્ર દ્વારા** મુલાકાત કરી આવી રહી છે. મોડાસા શહેરમાં બનાવી મોડાસા કાર્યવાહીનો પ્રારંભ ચંકા સા થી મોટાભાગની બિલ્ડિંગ, મોલ, શહેરમાં મોલ, -

ચકચારી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા

૩ આરોપીને ૩-૩ વર્ષની સજા

રાજ્ય નારકોટીક્સ કન્ટ્રોલ બાયપાસ માર્ગની માલપુર ચોકડી

બ્યુરો દ્વારા વર્ષ-૨૦૨૦માં નજીક વોચ ગોઠવી હતી.

મોડાસાના બાયપાસ માર્ગની દરમિયાન બાતમી મુજબની કાર

માલપુર ચોકડી નજીકથી આવી પહોંચતા એન.સી.બી.

કાશ્મીરથી લવાતો ૧૬.૭૫૫ ટીમે કોર્ડન કરી કારને અટકાવી

મોડાસા, તા.૩૦ એન.સી.બી. ટીમે મોડાસા

તપાસ કરતા કારમાંથી તેના ગુપ્ત

કરાયો હતો. આ કેસમાં ઉસ્ટીક્ટ

સોશન્સ કોર્ટે

રા કે શ

કાર્યવાહી કરવાના બદલે સેફ્ટીમાં બેદરકારી દાખવનાર સેફ્ટીના સાધનો ધૂળ ખાતા કામચલાઉ કામગીરી કરવામાં સામે પોલીસ ફરિયાદ કરવા હોવાની સાથે આકસ્મિક આગ આવતી હોય તેમ ફક્ત નોટિસ તંત્રને સૂચના આપવામાં આવી લાગે તો ઉપયોગ કઈ રીતે કરવો ફટકારી સંતોષ માની રહી છે. છે. અગાઉ સુરતમાં બનેલી તે માટે તાલીમબ્ધ સ્ટાફ નથી.

કિ.ગ્રામ ચરસના જથ્થા સાથે

તમામને ૧-૧ લાખનો

એક વર્ષની સજા

ભોગવવી પડશે

આરોપીઓને અરવલ્લી -

હુકમ કર્યો હતો.

હતો. આ ચકચારી ડ્રગ્સ હેરાફેરી અ બ દુ લ

કેસમાં કસૂરવાર ઠરેલા ૩ અજીજપઠાણ

ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટ દ્વારા ૩ (૨હે.જમ્મુ-

વર્ષની સખ્ કેદઅને રૂા.૧ કાશ્મીર),

લાખનાદંડની સજા ફટકારી હતી વિશાલ

જો દંડન ભરેતો વધુ ૧ વર્ષની મંડાેલા

જમ્મુ-કાશ્મીરથી કારમાં મોટો પ્રજાપા તિ

ચરસનો જથ્થો લઈ એક કાશ્મીરી (રહે.વડોદરા)ને

શખ્સ ગોધરા ડિલિવરી કરવા કસૂરવાર ઠેરવી

જતો હોવાની બાતમી રાજ્ય ૧૦વર્ષનીસમ્ર

નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરોને મળી કેદની સજા

હતી. આ બાતમીના આધારે કરી.

સપ્ત કેદની સજાનો ચુકાદો આપી (રહે.ગોધરા)

લાલિયાવાડી મોડાસા શહેર સહિત જિલ્લામાં ૩૦થી વધુ જિંદગી જીવતી દાખવનાર સ્થળોને તંત્ર સીલ થોડાસમય માટે કડકાઈ દાખવ્યા આગમાં ખાખ થયાની ઘટના મારી સમ્ર કાર્યવાહી કરી રહી બાદ ફરી પાછી તંત્રની ઢીલી બાદ મોડાસા નગરપાલિકા તંત્ર છે. મોડાસા શહેરમાં ફાયર નીતિના પરિણામે શહેરમાં — સેફ્ટી કમિટી આડેધડ નિયમો નેવે મૂકી ૩૦ બિલ્ડિંગો બનાવી ફાયર સેફ્ટી સ્થાળ નાી અંગે બેદરકારી દાખવવામાં કરવામાં આવી ટ્યૂશન ક્લાસીસ, લાઈબ્રેરી હાઈરાઈઝ બિલ્ડિંગ, ટ્યૂશન છે, હજુ કાર્યવાહી ચાલી રહી છે. સહિત અને કસ્થળો અને ક્લાસીસ સહિતના એકમમાં રાજ્યમાં સરકારે ફાયર કોમ્પ્લેક્ષમાં એન્ટ્રી ગેટ જ છે, તપાસ ધરાઈ છે. તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અંગે કાર્યવાહીના આદેશ એક્ઝિટ ગેટ નથી. મોલ સહિત સેફ્ટીની અમલવારી માટે સખ્ન કરવામાં આવ્યાં છે અને ફાયર બિલ્ડિંગમાં લગાવેલ ફાયર

મોડાસા શહેરમાં ફાયર સેફ્ટી કમિટી દ્વારા અત્યાર સુધી ૩૦ એકમની સ્થળ તપાસ કરવામાં આવી છે અને ફાયર સેફ્ટી અંગે ક્ષતિગ્રસ્ત સ્થળના જવાબદારોને નોટિસ આપવામાં આવી છે. સરકાર દ્વારા સમ્ર કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ કરવા સુધીની તંત્રને આદેશ છતાં તંત્રની ઢીલી નીતિ જેવી કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. જિલ્લાના તાલુકા મથકો સહિત અનેક ગ્રામ એક કાશ્મીરી યુવકને ઝડપ્યો ખાનામાંથી ૧૬.૭૫૫ કિ.ગ્રામ વિસ્તારોમાં મોલ અને હાઈવે ચરસનો જથ્થો રૂપિયા ૧ કરોડથી પર ધમધમતી આલિશાન વધુ કિંમતનો ઝડપી કેસ કર્યો હોટલ્સ અને બેંકવેટ હોલની **દંડ, દંડ ન ભરે તો વધુ** હતો. આ ચકચારી કેસમાં કેન્દ્ર ફાયર સેફ્ટીની ચકાસણી ક્યારે સરકાર દ્વારા રાફેમાનો આદેશ થશેની ચર્ચાએ જોર પકડ્યું છે.

KENVI JEWELS LIMITED CIN: L52390GJ2013PLC075720 Registered Office: Shop No.121 & 122 Super Mall Complex, Nr. Lal Bunglow, CG Road, Ahmedabad, Ellisbridge Gujarat- 380006 || Email id : compliance.kjl@gmail.com || Ph No.: 079-22973199, 2289109 || Web : www.kenvijewels.com STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2024 (Rs. in Lakh

Sr. No	Particulars	Quarter ended on 31-03-2024 Audited	Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2024 Audited	Year ended on 31-03-2023 Audited
1 2 3 4 5 6 7	Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted	3206.52 11.08 10.54 10.54 1263.80	8935.51 70.57 55.57 55.57 1263.80	2850.46 38.06 27.13 27.13 1011.04	12142.03 81.65 66.11 66.11 1263.80	8827.80 73.75 53.82 53.82 1011.04

Notes: (a) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 30.05.2024 (b) The Statutory Auditors have carried out Limited Review of the above standalone inancial results for the quarter ended on March 31st, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (c) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) ((d) The figures for the previous year/periods are re-arranged/re-grouped, wherever considered necessary. Place: Ahmedabad

For and on behalf of Kenvi Jewels Limited sd/- Chirag Valani, Managing Director - DIN: 06605257

VIVID MERCANTILE LIMITED Address: Basement, Medicare Centre, B/h. M.J. Library, Opp. Stock Exchange, Ellisbridge, Ahmedabad - 380006 Website: www.vividmercantile.com || Contact: 079-48921375 / 9824050899 || Email: complianceviel@gmail.com EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2024

Sr. No		Quarter ended on 31-03-2024 Audited	Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2024 Audited	Year ended on 31-03-2023 Audited
1 2 3 4 5 6 7	Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted	1195.19 1097.67 966.26 966.26 1,002.56	1637.57 396.07 331.53 331.53 1,002.56	480.82 326.61 326.61 326.61 1,002.56	2832.76 1493.74 1297.79 2279.76 1,002.56 4231.51	939.43 449.18 433.68 433.68 1,002.56 1951.75

Notes: 1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meetings held on 30th May, 2024.(2) The Audit is required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has been completed by Auditors of the company. (3) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same is available on the websites of the Stock Exchange and the listed entity. (4) Previous periods figures have been regrouped/reclassified where considered necessary to conform to current period's classification.

Place: Ahmedabad For Vivid Mercantile Limited

sd/- Satishkumar R. Gajjar, Managing Director - DIN: 05254111

S.M. GOLD LTD. CIN: U74999GJ2017PLC098438 Registered Office: Shop No. 1 to 3, 2nd Floor, 24 Caret Building, Opp. Rock Regency Hotel, Law Garden, C G Road, Ahmedabad Gujarat, 380009 || Email id : compliancesmgold@gmail.com || Tel. No. : +91- 9428980017/079-22114411 || Web : www.smgoldltd.com STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2024
(Rs. in Lakhs

Sr. No	Particulars	Quarter ended on 31-03-2024 Audited	Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2024 Audited	Year ended on 31-03-2023 Audited
2	Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax	3623.55 30.81 40.39	2698.40 103.74 78.74	2516.48 37.96 27.96	6321.95 134.55 119.13	5214.88 141.6 106.6
5	Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve	40.39 1003.75	78.74 1003.75	27.96 1003.75	597.34 1003.75 1208.51	106.6 1003.75 611.16
7	Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted	0.40	0.78	0.28	5.95	1.06

irectors at their meeting held on 30.05.2024 (b) The Statutory Auditors have carried out Limited Review of the above standalor financial results for the quarter ended on March 31st, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (c) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (d) The figures for the previous year/periods are re-arranged/re-grouped, wherever considered necessary. Place : Ahmedabad Date : 31/05/2024 For and on behalf of S.M. Gold Ltd sd/- Pulkitkumar Sureshbhai Shah, Managing Director - DIN: 07878190

SofTrak

SOFTRAK VENTURE INVESTMENT LIMITED CIN NO: L99999GJ1993PLC020939

Regd. Office: 201, Moon Light Shopping Centre, Nr. Maruti Towers, Drive in Road, Memnagar, Ahmedabad- 380052. Website: www.softrakventure.in | Email ID: softrakventure@gmail.com | Phone No: 9687002358 | Fax No: 079-6463141

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/YEAR ENDED MARCH 31, 2024 (Rs. In Lacs except Per share data)

Quarter Ended Year Ended Particulars 31.03.2024 31.12.2023 31.03.2023 31.03.2023 31.03.2024 Total Income from Operation 302.45 309.47 65.03 288.65 NetProfit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 287.53 0.11 41.60 22.69 NetProfit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items) 287.53 0.11 1.68 288.65 2.42 NetProfit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) 215.15 0.08 0.95 216.00 1.69 Total Comprehensive Income for the period [Compriing Profit/(Loss) for the period (after tax) 0.08 216.00 1.16 215.15 and Other Comprehensive Income (after tax)] **Equity Share Capital** 4507.79 4507.79 4707.79 4707.79 4707.79 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the 26.20 (188.95)(189.79)(189.79)previous year. Earning Per Share (Face Value of ₹2/- each) (for continuing and discontinued operations) 0.48 0.00 0.00 0.48 0.00 0.00 0.00

Notes: a. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed on a standalone basis filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly! Annual Financial Results are available on the websites i.e. www.bse.india.com

b. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors

For, SOFTRAK VENTURE INVESTMENT LIMITED

Raghvendra Kulkarni - Director - DIN:06970323

ા દ્વારા શહેરમાં વહીવટી - તંત્ર - દ્વારા - હોસ્પિટલો, ઈએસઆઈસી હોસ્પિટલ જ્યાં **ન્હાવા પડેલા 3માંથી બે ડૂબ્યા**

મોડાસા, તા.૩૦ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ ઝાંઝરી ધોધના ભોગીયા ધરામાં અમદાવાદના ઓઢવથી ત્રણ મિત્રો બાઈક લઈને ન્હાવા માટે આવ્યા હતા જેમાં ૩ યુવા મિત્રો ઝાંઝરી ધોધના પાણીમાં ન્હાવા ઉતર્યા હતા અને અચાનક એક પછી એક ૩ મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ

આવી ગયો હતો અને બુમાબુમ કરી મુકી હતી અને

SHUKRA PHARMACEUTICALS LIMITED CIN: L24231GJ1993PLC019079

Reg. Office: 3rd floor, Dev House, Opp. WIAA, Judges Bungalows Road, Bodakdev, Ahmedabad, Gujarat, 380054. Phone No.: 02764-286317. Email Id: info@shukrapharmaceuticals.com Website: http://www.shukrapharmaceuticals.com/

SHUKRA EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/YEAR ENDED MARCH 31, 2024 **Quarter Ended Particulars** No 31.03.2023 31.03.2024 31.12.2023 31.03.2023 31.03.2024 Total Income from Operation 4713.67 6003.04 1226.07 1945.29 7738.81 NetProfit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 522.35 952.94 396.42 1988 33 444.17 NetProfit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items) 522.35 952.94 396.42 1988.33 444.17 NetProfit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) 398.59 942.18 397.65 1853.72 440.65 942.18 1853.72 439.71 Total Comprehensive Income for the period [Compriing Profit/(Loss) for the period (after tax) 398.59 394,42 and Other Comprehensive Income (after tax)] 1094.70 1094.70 1097.70 1094.70 **Equity Share Capital** 391.42 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the 4669.27 4280.86 4669.27 2138.26 previous year. Earning Per Share (Face Value of ₹2/- each) (for continuing and discontinued operations) 3.64 8.61 23.46 16.93 26.21

3.64 8.61 23.46 16.93 26.21 The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed on a standalone basis filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly! Annual Financial Results are available on the websites i.e. www.bse.india.com and also on the company website https://www.shukrapharmaceuticals.com


b. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors.

Place : Ahmedabad Date : 29.05.2024

For, SHUKRA PHARMACEUTICALS LIMITED Dakshesh Shah - Managing Director - DIN:00561666

NAVKAR URBANSTRUCTURE LIMITED

CIN: L45200GJ1992PLC017761 Regd. Office: 304, Circle P, Near Prahlad Nagar, S.G. Highway, Ahmedabad - 380051. Telefax: (079) 48484095, Email id: navkarbuilders@yahoo.co.in Website: www.navkarurbanstructure.com



0.04 0.04 Notes: a. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed on a standalone basis filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly! Annual Financial Results are available on the websites i.e. www.bse.india.com and also on the company website https://www.navkarurbanstructure.com/

b. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors.

For, NAVKAR URBANSTRUCTURE LIMITED

Harsh Shah - Managing Director - DIN:01662085

એક હજારથી વધુ બાળકોએ કેમ્પનો લાભ લીધો



સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકો માટે આયોજિત યોગ સમર કેમ્પ સંપન્ન થયો હતો. (તસ્વીર : ફારુક ચૌહાણ - વઢવાણ)

વઢવાણ, તા.૩૦ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત શહેરી વિસ્તારોમાં આઈ.પી.એસ. રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોના સ્કૂલ, ૮૦ ફૂટ રોડ, સનશાઈન સ્કૂલ, સર્વાંગી વિકાસ માટે તા.૨૦/૫/ નવો ૬૦ ફૂટ રોડ, વિવેકાનંદ સ્કૂલ, ૨૦૨૪ થી તા.૨૯/૫/૨૦૨૪ સુધી ભક્તિનંદન સર્કલ પાસ, ડાયમંડ નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન જયુબિલી સ્કુલ, શ્રવણ ટોકીઝ પાસે

યુવકોના મૃત-અને તાલુકા વિસ્તારમાં, ધ્રાંગધ્રા દેહ ફાયર આર્ય સમાજ મંદિર, લખતર એ.વી. ઓઝા સ્કૂલ, લીંબડી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સાયલા શખપર પ્રાથમિક શાળા એમ અલગ–અલગ ૮ સ્થળોએ યોગ સમર કેમ્પ યોજાયો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ

આ કેમ્પમાં ૭થી ૧૫ વર્ષના ચાૈહાણ ૧૦૦૦થી વધુ બાળકો જોડાયા હતા. (ઉ.વ.૨૧) આ કેમ્પમાં ગીતાજીના શ્લોક, વૈદિક અને પરાગ યજ્ઞ, મંત્રના ઉચ્ચારણથી શરૂ કરી વસંતભાઈસુથાર ઊંચાઈ વધારતા, પાચન તંત્ર મજબૂત (ઉ.વ. ૨૦) બનાવતા, યાદશક્તિ વધારતા બજ્ઞે રહે. આસન તેમજ પ્રાણાયામ કર્યા બાદ અમદાવાદના યાદશક્તિ અને એકાગ્રતા વધારતી હતા જયારે વિવિધ રમતો બાળકો ને શીખવવામાં જીતેન્દ્ર ભરત આવી હતી તેમ કોર્ડીનેટર નીતા ભાઈ પરમાર દેસાઈની યાદીમાં જણાવાયું છે. બચી ગયો હતો.

બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. પોલીસે બંને મૃતદેહને કરાવ્યા હતા. મૃતાક યુવકો નાી ઓળખ થઈ હતી તેમાં પ્રવિશ સુખદેવ સિંહ

પોલીસને જાણ

થતાાં ઘટનાા

સ્થળે આવી

પહોંચી હતી.

મોડી સાંજે બે

Place: Ahmedabad Date: 28.05.2024





















